https://archive.org/details/bk1398/page/n0/mode/1up

2013-02 -Patidar Saurabh (1398)

All Items on https://archive.org/details/realpatidar

Full Library on https://realpatidar.com/library

ફેબ્રુઆરી ૨૦૧૩

પાટીદાર સૌરભ

ત્રિવાર્ષિક લવાજમ રૂા.૩૦૦

નવનિર્વાચિત ધારાસભ્યનું ઠેર-ઠેર સન્માન

જબલપુરમાં કેન્દ્રીય કારોબારી મળી

હૈદ્રાબાદમાં યોજાયો ફેમીલી બિઝનેસ સેમીનાર

જય લક્ષ્મીનારાયણ !

માંડવી ઝોનનું શુધ્ધિકરણ...

તો

મુંબઈમાં શુધ્ધ સનાતની સમાજની સ્થાપના

realpatidar.com

https://archive.org/details/bk1398/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 2, 3, 5.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v18.py

https://archive.org/details/bk1398/page/n2/mode/1up

2013-02 -Patidar Saurabh (1398)

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN,
o=realpatidar.com,
email=mail@realpatidar.com
Reason: I have reviewed this
document
Date: 2026.02.23 14:52:36 +05'30'

ફેબ્રુઆરી ૨૦૧૩

પાટીદાર સૌરભ

ત્રિવાર્ષિક લવાજમ રૂ.૩૦૦

realpatidar.com

નવનિર્વાચિત ધારાસભ્યનું ઠેર-ઠેર સન્માન

જબલપુરમાં કેન્દ્રીય કારોબારી મળી

હૈદ્રાબાદમાં યોજાયો ફેમીલી બિઝનેસ સેમીનાર

જય લક્ષ્મીનારાયણ !

માંડવી ઝોનનું શુધ્ધિકરણ...

તો

મુંબઈમાં શુધ્ધ સનાતની સમાજની સ્થાપના

realpatidar.com

https://archive.org/details/bk1398/page/n3/mode/1up

realpatidar.com

Mandvi Zone Reformation

ઝોન પ્રમુખપદે દામજીભાઈ વાસાણીની વરણી

કેન્દ્રીય સમાજના આદેશ મુજબ માંડવી ઝોનની નવી કારોબારી રચાઈ

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના આદેશ મુજબ કચ્છના માંડવી ઝોનની નવી કારોબારીની રચના કરવામાં આવતાં છેલ્લા લાંબા સમયથી માંડવી ઝોનને લઈ સમાજમાં ચાલતી અટકળોનો અંત આવ્યો છે.

માંડવી તાલુકાના રાયણ મોટી ખાતે તા.૨૧-૧-૧૩ના કેન્દ્રીય સમાજના ઉપપ્રમુખ શ્રી મણીલાલ હીરજી ભગતના અધ્યક્ષસ્થાને મળેલ માંડવી ઝોનની બેઠકમાં આ વરણી કરવામાં આવી હતી. કેન્દ્રીય સમાજના કારોબારી સભ્યો શ્રી મણીલાલ કેસરા માવાણી (વરજડી), શાંતિલાલ પ્રેમજી દિવાણી (રાયણ), બાબુલાલ વિશ્રામ દડગા (મમાયમોરા), જેન્તીલાલ દેવજી રામાણી (જામથડા), મણીલાલ ભાણજી અમૃતિયા (શ્રીરામનગર), રમેશ ખીમજી ચોપડા (લાયજા) તેમજ સ્થાનિક સમાજના વડીલોએ મંચ પર સ્થાન શોભાવેલ.

દીપ પ્રાગટ્ય બાદ કાન્તીલાલ રાયણવાળાએ સ્વાગત પ્રવચન કરેલ. દામજીભાઈ વાસાણીએ કેન્દ્રીય સમાજનો તા.૨૫-૯-૨૦૧૨ વાળો ઠરાવ વાંચી સંભળાવેલ જેમાં માંડવી ઝોનને બરખાસ્ત કરવામાં આવેલ છે. તેમણે જણાવેલ કે માંડવી ઝોનના પૂર્વપ્રમુખ કેન્દ્રીય સમાજને કોઈ ખુલાસા આપી શક્યા નથી અને કારોબારીને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

નવી કારોબારીની રચના માટે સભામાંથી સૂચનો લેવામાં આવેલ જેમાં દરેક ગામના પ્રતિનિધિઓએ સૂચનો આપેલ. જેમાં મોટાભાગના સભ્યોનો સૂર એવો હતો કે જેને પણ લો પાકા સનાતની હોવા જોઈએ. નવી કારોબારીની વરણી કરવા માટે સભા અધ્યક્ષને પંચ નીમવાની સત્તા આપવામાં આવેલ અને આ પંચ જે કારોબારી નીમે તે માન્ય રાખવા સર્વાનુમતે નક્કી કરવામાં આવેલ.

ત્યારબાદ અધ્યક્ષશ્રીએ સાત વ્યક્તિને પંચ તરીકે નિમેલ. પંચે તેમનો નિર્ણય વાંચી સંભળાવેલ જેમાં ૧૨ હોદ્દેદારો અને ૪૧ સભ્યોના નામ જાહેર કરેલ. માંડવી ઝોનના પ્રમુખ તરીકે દુર્ગાપરના દામજી હીરજી વાસાણી પર કળશ ઢોળવામાં આવેલ.

સભામાં ઉપસ્થિત માંડવી ઝોનના સભ્યોએ નવી કારોબારીને અને હોદ્દેદારોને તાળીઓના ગડગડાટથી વધાવી લીધેલ. નવા વરાયેલા પ્રમુખશ્રી દામજીભાઈએ જણાવેલ કે પંચે જવાબદારી સોંપી છે તો તમારા સૌના સાથ સહકારથી સમાજને પ્રગતિને પંથે લઈ જઈશું. કેન્દ્રીય સમાજની જે ચોખ્ખી સનાતની સમાજની નેમ છે તે સંગઠીત અને એકતાથી સાકાર કરશું.

પ્રમુખસ્થાનેથી મણિલાલ ભગતે જણાવેલ કે માંડવી ઝોનની રચના લોકશાહી ઢબથી કરવામાં આવેલ છે માંડવી ઝોન એકલા પાંચ-દસ જણનો ઈજારો નથી.

આભાર દર્શન પ્રભુલાલ સેંઘાણીએ કરેલ. સભાનું સંચાલન દામજીભાઈ વાસાણી અને ડાયાભાઈ માવાણીએ કરેલ. યુવક મંડળ રાયણના સભ્યોએ વ્યવસ્થા સંભાળેલ.

❖

માંડવી ઝોનના નવા હોદ્દેદારો

પ્રમુખ	-	દામજી હીરજી વાસાણી	દુર્ગાપુર
ઉપપ્રમુખ	-	ભવાનજી નારણ પોકાર	જનકપુર
ઉપપ્રમુખ	-	કાન્તીલાલ ભાણજી અમૃતિયા	શ્રીરામનગર
ઉપપ્રમુખ	-	દિનેશ ગોપાલ સેંઘાણી	મમાયમોરા
મહામંત્રી	-	ડાહ્યાલાલ જેઠા માવાણી	વરજડી
સહમંત્રી	-	પ્રભુલાલ પચાણ સેંઘાણી	દુર્ગાપર
સહમંત્રી	-	ધીરજલાલ સામજી ચોપડા	જનકપુર
સહમંત્રી	-	શાન્તીલાલ પ્રેમજી દડગા	બીદડા
ખજાનચી	-	લક્ષ્મીચંદ ધનજી સેંઘાણી	રાયણ
સહખજાનચી	-	જયેશ દેવજી ધોળુ	જામથડા
સહખજાનચી	-	જેન્તીલાલ દેવજી ભગત	ભેરૈયા
સહખજાનચી	-	રવજી વાલજી રૂડાણી	નાની ખાખર

પાટીદાર સૌરભના નવા ગ્રાહકોને પણ વી.પી.પી.થી અંકો મોકલવામાં આવશે

જો આપ પાટીદાર સૌરભના ગ્રાહક થવા માંગતા હો અને લવાજમ ભરવામાં આપને મુશ્કેલી થતી હોય તો આપની વિનંતી મળેથી વી.પી.પી. દ્વારા પણ આપને અંક મોકલી આપવામાં આવશે.

- ❖ *વી.પી.પી. માટે પત્ર લખો અથવા ઈમેલ કરો.*
- ❖ *આપનું સરનામું સંપૂર્ણ વિગતે, પીનકોડ નંબર સાથે લખો.*
- ❖ *પાટીદાર સૌરભનું ઈ-મેલ એડ્રેસ છે :*

patidarsaurabh@yahoo.co.in

realpatidar.com

https://archive.org/details/bk1398/page/n4/mode/1up

2013-02 -Patidar Saurabh (1398)

Laxminarayan Samaj Mumbai Foundation Formation #History

સંતશ્રી ઓધવરામજીની નિર્વાણ તિથિના દિવસે

શ્રી કચ્છી કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ-મુંબઈની સ્થાપના

સનાતન સમાજની રચના માટે વિસ્તારિત એડહોક સમિતિની દ્વિતીય મીટીંગ તા.૨૩-૧-૨૦૧૩ના રોજે બપોરના ૩.૩૦ કલાકે વડીલ શ્રી રતિલાલભાઈ મણીભાઈ રામાણીના અધ્યક્ષ સ્થાને ઘાટકોપર ઈસ્ટ મધ્યે રતનશી ખીમજી પટેલ (ખેતાણી) બિલ્ડીંગ મધ્યે મળેલ જેમાં સમિતિના સભ્યો બહોળી સંખ્યામાં હાજર રહેલ.

શ્રી ગૌતમભાઈ કેશરાણીએ સભાનું સંચાલન સંભાળેલ. બંધારણ સમિતિના સભ્યોને સ્થાન ગ્રહણ કરાવી, વડીલ શ્રી રતિલાલભાઈ રામાણીના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવેલ, જેને બંધારણ સમિતિના સભ્યોએ સાથ આપેલ. ત્યારબાદ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ તેમજ કુળદેવી મા ઉમિયા તથા સત્ય સનાતન ધર્મના જયઘોષ સાથે સભાનું કાર્ય આરંભ કરેલ.



મુંબઈમાં શુદ્ધ સનાતની સમાજની રચના માટે ઘાટકોપરમાં મળેલ બેઠકમાં ઉપસ્થિત સમાજના મહાનુભાવો.

પ્રથમ એડહોક સમિતિ તા.૮-૧૨-૧૨ના મળેલ, જેમાં ૨૪ સભ્યો હાજર હતા અને અન્ય ૨૦ સભ્યોના નામ ફોનથી તેમને પૂછીને નક્કી કરવામાં આવેલ. આ પ્રથમ મીટીંગમાં હાલની સામાજિક પરિસ્થિતિ અંગે ચર્ચા કરતા સર્વે ભાઈઓએ લક્ષ્મીનારાયણ સનાતન વિચાર ધારા ધરાવતા આપણા જ્ઞાતિજનોની સનાતની સમાજ મુંબઈ મધ્યે બનાવવા અનુરોધ કરેલ. આ બાબત સર્વાનુમતિ મળતાં જ હાજર સભ્યોએ બંધારણ સમિતિની રચના કરાવેલ. જેમાં (૧) રતિલાલભાઈ રામાણી (૨) ચંદુભાઈ નાકરાણી (૩) ભવાનજીભાઈ લીંબાણી (૪) હિંમતભાઈ ખેતાણી (૫) અરૂણભાઈ નાકરાણી (૬) કેશવલાલ લીંબાણી અને (૭) ગૌતમભાઈ કેશરાણી એમ સાત જણાને નવી સમાજનું બંધારણ સત્વરે તૈયાર કરવા જણાવેલ.

આ સભામાં સમગ્ર મુંબઈમાંથી સમાજના મુખ્ય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યવાહીમાં ભાગ લીધો હતો.

આજની સભામાં સંયોજક (કન્વીનર) તરીકે વડીલ શ્રી ધનજી શિવગણ રૂડાણીની નિમણુંક સર્વાનુમતે કરવામાં આવેલ. તેઓ શ્રી હાજર ન હતા, પરંતુ ફોન દ્વારા તેમની સહમતી લેવામાં આવેલ. ત્યારબાદ સહ-સંયોજક (જોઈન્ટ કન્વીનર) તરીકે શ્રી કેશવલાલ દામજી લીંબાણી અને શ્રી અરૂણભાઈ નાકરાણીની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવેલ. ત્યારબાદ ઉપરોક્ત બંધારણ સમિતિએ 'શ્રી કચ્છી કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ-મુંબઈ'નું બંધારણ તૈયાર કરેલ જેની આજની એડહોક સમિતિની મીટીંગમાં રજૂઆત કરવામાં આવેલ.

બંધારણનું વિગતવાર વાંચન શ્રી ભવાનજીભાઈ લીંબાણીએ કરેલ. હાલ આ

realpatidar.com

https://archive.org/details/bk1398/page/n5/mode/1up

realpatidar.com

બંધારણ અંગ્રેજીમાં તૈયાર કરેલ છે, જેથી તેનું વિસ્તારથી ગુજરાતીમાં અનુવાદ કરી રજુઆત કરવામાં આવેલ. બંધારણના વાંચન દરમ્યાન હાજર બુદ્ધિજીવી સભ્યોએ સક્રિય પણે વિચાર વિમર્શ કરેલ અને તેમના દ્વારા રજુ કરવામાં આવેલ જરૂરી સૂચનોની નોંધ લેવામાં આવી. મુખ્યત્વે વડીલ શ્રી રતનશી મુલજી વાસાણી, યુવાન નેતાઓ પ્રકાશ માવાણી, કીર્તિ દીવાણી, મહેન્દ્ર સેંઘાણી, ચંદ્રકાંત છાભૈયા, તેમજ શાંતિલાલ લીંબાણી, માવજીભાઈ જબુવાણી, મનુભાઈ રંગાણી, હીરાભાઈ પોકાર એમ સર્વે ભાઈઓએ ચર્ચા કરી સુચન આપેલ. આવેલ સુચનોને ધ્યાનમાં લઈ, જરૂરી અને આવશ્યક ફેરફાર કરવાની સત્તા બંધારણ સમિતિ અને એડહોક સમિતિના સંયોજકશ્રીઓને આપવામાં આવેલ છે. ત્યારબાદ બંધારણને હાજર સર્વે સભ્યોએ સર્વાનુમતે બહાલી આપેલ. આપણી જ્ઞાતિને ધાર્મિક અંધકારમાંથી બહાર લાવનાર ખરા સંત શ્રી ઓધવરામજી મહારાજ કે જેમની આજ રોજ નિર્વાણ તિથિ છે, એવા સંત શ્રી ઓધવરામજી મહારાજની પ્રેરણા અને કૃપાથી, તેમના બતાવેલ માર્ગ પર ચાલીને આ લક્ષ્મીનારાયણ સનાતન સમાજની સ્થાપનાને મૂર્ત સ્વરૂપ આપવામાં આવેલ.

આ બંધારણ તૈયાર કરવામાં ખાસ અરૂણભાઈ તેમજ રતિલાલભાઈએ ખૂબ જ સારી મહેનત કરેલ, જે શ્રી ભવાનજીભાઈએ જણાવતા હાજર સભ્યોએ તાળીઓથી તેને વધાવી લીધી. સભાના અંતમાં શ્રી કેશવલાલ લીંબાણીએ આભાર વિધિ કરેલ. ત્યારબાદ દરેક સભ્યોએ પ્રસાદ લીધો. ત્યારબાદ સભ્યોએ ખૂબ જ ઉત્સાહથી દરેક વિસ્તારના સ્વયંમ-સેવલકોએ સ્વેચ્છાથી નામો નોંધાવેલ.

આ સમાજનું બંધારણ તથા સભ્ય બનવા માટે અરજીપત્રકની કોપી આ સમાજની વેબસાઈટ "KkpLaxminarayanMumbai.org" (ટૂંક સમયમાં) પરથી ડાઉનલોડ કરી શકશો. સમાજનું ઈમેલ આઈડી છે KkpLaxminarayanMumbai@gmail.com આજના બંધારણમાં જણાવ્યા પ્રમાણેના વિસ્તારમાં રહેતા ૧૮ વર્ષ પૂરા કરી ચૂકેલા સનાતની ભાઈ-બહેનો રૂા.૨૦/- આજીવન સભ્ય ફી ભરીને સમાજના નોંધણીકૃત સભ્ય (રજિસ્ટર્ડ મેમ્બર) બની શકે છે. કોઈ પણ જાતના પૂર્વગ્રહ વગર સમાન વિચારધારાવાળી આપણી જ્ઞાતિની બધી જ સંસ્થાઓને સાથે લઈને સમાજની એકતા અને વિકાસના કાર્યો કરવાના ઉમદા ઉદ્દેશથી સ્થાપવામાં આવેલ આ સમાજના સભ્ય બનવા અમો આપણી જ્ઞાતિના લક્ષ્મીનારાયણ, સ્વામીનારાયણ, સત્યનારાયણ તથા આર્ય સમાજની વિચારધારામાં વિશ્વાસ રાખતા સર્વે ભાઈ-બહેનોને હાર્દિક આમંત્રણ આપીએ છીએ. ❖

SOHOM deceuninck
Opportunity to set up a new business in uPVC DOORS & WINDOWS

SOHOM EVENT OF THE MONTH
SOHOM plans to open area representation offices throughout major cities of India. Interested parties may respond with infrastructure available for office & showroom to: Email:opportunity@sohom.in / Mob:+91 88017 35451.

SOHOM offers franchise for starting a new business in uPVC Doors & Windows fabrication & sale.

SOHOM OFFERS
- uPVC Door & Window Profiles, Reinforcement, Hardware & Accessories
- uPVC Door & Window Fabrication Machines
- uPVC Door & Window Fabrication Training & Guidance.

Licensed Distributor for: deceuninck elumatec

FOR A BETTER TOMORROW...... FOR ALL OF US...... THERE IS BUSINESS AND SUCCESS......

SOHOM FENSTERTECH PVT LTD.
D - 172, PHASE - III, IDA JEEDIMETLA, HYDERABAD - 500 055, MBL: +91 9440066864, Email: info@sohom.in web: www.sohom.in

Link: http://www.realpatidar.com/library Page 4 of 6
email: mail@realpatidar.com

realpatidar.com

યાદગાર બની રહેશે એમ પણ જણાવેલ હતું.

સમાજના વડીલ શ્રી કે.કે. પટેલે પોતાના મંતવ્યમાં કહેલ કે આ ત્રણ દિવસીય હેલ્થ કેમ્પનું આયોજન ખૂબ જ શિસ્તપૂર્વક કરવામાં આવેલ જેથી તેને સારી સફળતા મળેલ. જે યુવક મંડળના અથાગ પરિશ્રમનું પરિણામ છે.

સ્વાસ્થ્ય સમિતિના અધ્યક્ષ શ્રી મહેશભાઈ પચાણ રવાણીએ પોતાના મંતવ્યમાં સમાજે એમની ઉપર વિશ્વાસ રાખી એમને જે અગત્યની જવાબદારી સોંપેલ તેને સારી રીતે પાર પાડવા માટે પૂર્વ તૈયારીઓ માટે દિવસ રાત પોતાનો સક્રિય યોગદાન આપેલ. સ્વાસ્થ્ય સમિતિના સભ્યો તથા મહિલા મંડળની સ્વયંસેવક બહેનોનો ખૂબ ખૂબ આભાર માનેલ હતો અને "સ્વસ્થ રહો, વ્યસ્ત રેહો, મસ્ત રહો" ના નારા સાથે સમસ્ત પરિજનોને સ્વસ્થ રહેવા અપીલ કરી હતી.

સમાજના મહામંત્રી શ્રી પુરૂષોત્તમભાઈ માવજી નાકરાણી, યુવક મંડળના મહામંત્રી શ્રી જીતેન્દ્રભાઈ રતનશી પોકાર અને યુવક મંડળના સલાહકાર શ્રી રમેશભાઈ મુળજી ગોરાણીએ પણ પોતાના મંતવ્યો રજુ કર્યા હતા.

અંતમાં સમાજના પ્રમુખ શ્રી બાબુલાલ વાલજી ભગતે પોતાના મંતવ્યમાં જણાવેલ કે આ હેલ્થ કેમ્પની સફળતાનું સંપૂર્ણ શ્રેય સ્વાસ્થ્ય સમિતિના કન્વીનરો શ્રી મહેશભાઈ પચાણ રવાણી તથા પ્રવીણભાઈ ધીરજ પોકાર તથા તેમના સહયોગી સ્વયંસેવક ભાઈ-બહેનોના ફાળે જાય છે. ❖

બાજુના જ ઓરડામાંના મા-બાપની બૂમ ન સાંભળી શકનાર બાળકના કાનના પડદા દૂર દૂરથી આવતો બરફના ગોળાની લારીનો ગમે તેવો ઝીણો અવાજ પણ ઝીલી શકે છે.

Mandvi Hostel Issue Scam

પશ્ચિમ કચ્છના મુખ્ય મથક નખત્રાણા ખાતે નવનિર્મિત નાયબ કલેક્ટર કચેરીનું રાજ્યના મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના વરદ્ હસ્તે ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું.

માંડવી હોસ્ટેલ પ્રકરણે જાહેર સ્પષ્ટતા

માંડવીમાં કેન્દ્રીય સમાજની મિલકત કેટલાક ટ્રસ્ટી સહિતના આગેવાનો દ્વારા ઓળવી જવાના ચોંકાવનારા કિસ્સા બાદ જ્ઞાતિના મુખપત્રોમાં આ અંગે વિગતવાર અહેવાલો પ્રસિદ્ધ થતાં માંડવી વિસ્તારના જ્ઞાતિના કેટલાક આગેવાનો દ્વારા આ અહેવાલોને કારણે પોતાની બદનક્ષી થઈ રહી હોવાની લાગણી વ્યક્ત કરવામાં આવી છે.

માંડવી પ્રકરણે તો કેન્દ્રીય સમાજ દ્વારા પોલીસ ફરીયાદ નોંધવા અરજી કરવામાં આવી છે અને આ અરજીમાં સમાજની મિલકત પચાવી પાડવાના ગેરકાયદે કૃત્યમાં કોણ-કોણ સંડોવાયેલા છે તેનો સ્પષ્ટ નામોલ્લેખ પણ કરવામાં આવેલ છે. કેન્દ્રીય સમાજ દ્વારા જ્ઞાતિજનો જોગ કચ્છના અખબારોમાં આ અંગે જાહેર નિવેદન પણ બહાર પાડવામાં આવેલ છે.

પાટીદાર સૌરભમાં તો આ કૌભાંડ અંગે કેન્દ્રીય સમાજ દ્વારા જે કાર્યવાહી થઈ તેનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. માંડવી પ્રકરણ બહાર આવ્યા બાદ જે કંઈ ઘટનાઓ બની, એકતામંચના નામે જે કંઈ 'નાટકો' થયા તે બધાના અહેવાલો પ્રસિદ્ધ થયેલા છે તે બધા જગજાહેર છે અને હજ્જારો લોકોએ તે નજરે જોયેલા છે !

આ તમામ પ્રવૃત્તિમાં ભાગ લેનારના નામ અહેવાલમાં આવે તે સ્વાભાવિક છે. જેમાં કોઈની બદનક્ષી કરવાનો અમારો લેશમાત્ર ઈરાદો નથી. આપણા કૃત્યને કારણે સમાજમાં આપણી બદનામી થતી હોય તો તેમાં બીજાને દોષ દેવાનો મતલબ શું છે? સમાજમાં આવાં કલંકિત કૃત્ય ન કરવા તે જ તેનો શ્રેષ્ઠ ઉપાય છે.

અમે અગાઉ પણ સ્પષ્ટતા કરી ગયા છીએ અને હજુ પણ કરીએ છીએ કે પાટીદાર સૌરભ કોઈની બદનામી કરવામાં કે ઉતારી પાડવામાં માનતું નથી. જે કંઈ છે તે સ્પષ્ટપણે જાહેર કરવામાં માને છે.

માંડવી પ્રકરણ બાદ તેને સંલગ્ન જે કંઈ સભાઓ કે મિટિંગો થઈ તેની વિડીયો સી.ડી. જોઈ જવા અમે આગ્રહ કરીએ છીએ. સમાજમાં કોણ, કેવી પ્રવૃત્તિ કરે છે તે બધું સ્પષ્ટ થઈ જશે.

- માનદ્ તંત્રી

realpatidar.com

https://archive.org/details/bk1398/page/n7/mode/1up

2013-02 -Patidar Saurabh (1398)

PATIDAR SAURABH (Monthly)

Regd. No. GKCH / 88-A / 2012 - 2014
RNI No. GUJGUJ / 2001 / 6356

realpatidar.com

Printed, Published and owned by Neeta Patel and printed at Allied Offset, Gomtipur - Ahmmedabad and Published at Nakhatrana (Kachchh). Editor : C.K. Patel.

Sweta Offset Pvt. Ltd. Ph. : 22940375

realpatidar.com